

॥ हरिःॐ ॥



प्रसादी

श्रीमोटा

: संकलन कर्ता :
श्री बाबुभाई रामी

: संपादक :
डॉ. कांतिभाई रामी
डॉ. कांतिभाई नावडिया

: प्रकाशक :
हरिःॐ आश्रम, सुरत

- પ્રકાશક : ટ્રસ્ટીમંડળ,
 હરિઃઊં આશ્રમ, સ્થાપના વર્ષ ૧૯૫૬
 કુરુક્ષેત્ર મહાદેવના મંદિરની બાજુમાં,
 જહાંગીરપુરા, રાંદેર, સુરત-૩૮૫ ૦૦૪.
 ફોન : (૦૨૬૧) ૨૭૬૫૫૬૪
- હરિઃઊં આશ્રમ, સુરત, નડિયાદ.
- | | | |
|-----------|------|-------|
| □ આવૃત્તિ | વર્ષ | પ્રત |
| પ્રથમ | ૨૦૦૮ | ૫૦૦૦ |
| બીજી | ૨૦૦૯ | ૨૫૦૦૦ |
| ત્રીજી | ૨૦૧૧ | ૨૫૦૦૦ |
- પૃષ્ઠ : ૬૪
- કિંમત : રૂ. ૩/-
- પ્રાપ્તિસ્થાન : હરિઃઊં આશ્રમ, સુરત, નડિયાદ
- મુદ્રણશુદ્ધિ : જ્યંતીભાઈ જાની
 ફોન : (૦૭૯) ૨૬૬૧૨૭૨૮
- ડિઝાઇનર : મયૂર જાની, મો. : ૮૪૨૮૪૦૪૪૪૩
- મુદ્રક : અર્થ કોમ્પ્યુટર, અમદાવાદ-૧૪,
 મો. ૮૩૨૭૦૩૬૪૧૪, ફોન : ૨૭૫૪૩૬૮૮

સંપાદકનું નિવેદન

આત્મોદ્ધારક, સમાજસુધારક, અને કભકતોના ભાગ્યવિધાયક પૂજ્ય શ્રીમોટાએ શ્રેયાર્થીની જીવનસાધનામાં સીધા ઉપયોગી થાય એવા જે વિચારો વખતો વખત પ્રગટ કરેલા, તેનો આ તદ્દન નાનકડો અને હાથવગો સંગ્રહ, લખાણોના માર્ગદર્શન ઉપરાંત પૂજ્ય શ્રીમોટાની તસવીરોને કારણે સૌ ભાવિકોનો હાર્દિક સ્વીકાર પામશે એવી આશા-અપેક્ષાએ સુશીજનોના કરકમલમાં મૂકતાં અમે ઊડો આનંદ અનુભવીએ છીએ.

: સંપાદક :

ડૉ. કંતિભાઈ નાવડિયા ડૉ. કંતિભાઈ રામી

પ્રકાશકનું નિવેદન (પ્રથમ આવૃત્તિ)

આ પહેલાં શ્રી બાબુભાઈ રામી દ્વારા સંકલિત પુસ્તકો 'હુર્લભ દેહ મનુષ્યનો', 'સાધનાપથનાં શિખરો' તથા 'બે બોલ' પુસ્તકો પ્રકાશિત કરવામાં સર્વ શ્રી અનિલભાઈ રામી, લેખાડિયા પરિવાર (કુનાલ ઓર્ગનિક્સવાળા) તથા શ્રી પી.ટી.પટેલ પરિવાર (કુંજરાવ) તરફથી સંપૂર્ણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.

ઉપરોક્ત પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકો હરિઃઊં આશ્રમ, સુરત તથા નડિયાદને ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યાં હતાં. કેટલાંક પુસ્તકો પૂજ્ય શ્રીમોટાના અનુરાગીઓને ભેટસ્વરૂપે અપાયેલ હતાં. વધેલ જૂજ પુસ્તકો અડધી કિંમતે (૫૦% રાહતથી) વેચાયેલ હતાં. આમ, ઉક્ત વધેલ પુસ્તકોના વેચાણ દ્વારા મળેલ નાણાંથી તેમ જ શ્રી બાબુભાઈ રામી અને પૂજ્ય શ્રીમોટાના ૧૧૧મા જન્મદિનની ૩૪વણીના યજમાન

શ્રી ગોરધનભાઈ પટેલ દ્વારા પ્રાપ્ત થયેલ આર્થિક સહયોગથી આ પુસ્તિકા પ્રકાશિત થઈ રહી છે. અહીં આ સર્વનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.

‘પ્રસાદી’ પુસ્તિકામાં સંગ્રહિત વિચારો પૂજ્ય શ્રીમોટા દ્વારા લિખિત ‘જીવન પોકાર’, ‘જીવન-દર્શન’, ‘જીવન સંદેશ’, ‘જીવન મંડાણ’, ‘જીવન પગથી’, ‘જીવન પગરણ’, ‘જીવન સોપાન’, ‘જીવન પ્રવેશ’, ‘જીવન મંથન’, ‘જીવન સંશોધન’, ‘જીવન પાથેય’, ‘જીવન પ્રેરણા’, શેષ વિશેષ, જોડા જોડ, એકીકરણ સમીકરણ, ‘અગ્રતા એકાગ્રતા’, ‘અન્વય સમન્વય’ તથા પૂજ્ય શ્રીમોટાની ટેપરેકોર્ડ વાણીમાંથી લેવાયેલ છે. પ્રત્યેક વિચારકંડિકાને અંતે પુસ્તકનું નામ તથા પૃષ્ઠ નંબર લખવાનું એટલા માટે ટાળ્યું છે કે વાચકોના વિચારગ્રહણમાં ક્ષતિ ન થાય.

આશા છે કે વાચકો આ ‘પ્રસાદી’ને વધાવશે !

પ્રકાશકનું નિવેદન (ત્રીજ આવૃત્તિ)

પૂજ્ય શ્રીમોટાના પ્રકાશિત વિવિધ સાહિત્યમાંથી અમદાવાદના શ્રી બાબુભાઈ રામીએ કરેલ સંકલન ‘પ્રસાદી’નું પ્રથમ પ્રકાશન પારિજ્ઞ હરિ શેરદલાલ દ્વારા સને ૨૦૦૮માં થયું હતું, તે પછી તેની બીજ આવૃત્તિ સને ૨૦૦૯માં થઈ હતી.

‘પ્રસાદી’ની માંગ સ્વજનો તેમ જ હરિઃઊં સત્સંગ મંડળ, અમદાવાદ તરફથી થતાં અને હાલ તેની પ્રતો ઉપલબ્ધ ન હોઈ તેના પ્રકાશન માટે પારિજ્ઞ શેરદલાલ તરફથી ઉદારભાવે અમોને અનુમતિ મળતાં આ ત્રીજ આવૃત્તિનું પ્રકાશન કરતાં ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. આશા છે કે સ્વજનો આ આવૃત્તિને આવકારશે.

ટ્રસ્ટીમંડળ, હરિઃઊં આશ્રમ,

તા. ૧૨-૪-૨૦૧૧

સુરત-૩૮૫૦૦૫

રામનવમી

અનુક્રમણિકા

ક્રમ	કૃતિ	પૃષ્ઠ નંબર
૧.	શ્રીસદ્ગુરુ	૮
૨.	સંસ્કાર	૧૦
૩.	વિચાર	૧૧
૪.	પ્રાણ	૧૪
૫.	અહમ્	૧૬
૬.	બુદ્ધિ	૧૭
૭.	મન	૨૧
૮.	ધ્યેય	૨૪
૯.	પ્રાર્થના	૨૬
૧૦.	નામસ્મરણ	૨૮
૧૧.	મનન ચિંતવન	૩૦
૧૨.	કર્મ	૩૧
૧૩.	અંતર્મુખતા	૩૩
૧૪.	સંયમ	૩૪
૧૫.	જાગૃતિ	૩૭
૧૬.	ઝંખના	૩૮
૧૭.	નિશ્ચય	૪૦

૧૮.	સંકલ્પ	૪૧
૧૯.	તટસ્થતા	૪૨
૨૦.	આત્મવિશ્વાસ	૪૩
૨૧.	અત્યાસ	૪૪
૨૨.	વૈરાગ્ય	૪૬
૨૩.	આત્મનિવેદન	૪૭
૨૪.	સમર્પણભાવ	૪૮
૨૫.	શરણભાવ	૪૯
૨૬.	ત્રાટક	૫૦
૨૭.	શ્રદ્ધા	૫૧
૨૮.	એકાગ્રતા	૫૨
૨૯.	ધ્યાન	૫૪
૩૦.	ભાવ	૫૫
૩૧.	પ્રેમ	૫૬
૩૨.	ગુણભાવની કદર	૫૭
૩૩.	દુર્લભ દેહ મનુષ્યનો	૫૮
૩૪.	મૃત્યુ પછી જીવાત્માની સ્થિતિ	૫૯
૩૫.	આરતી	૬૧
૩૬.	પ્રાર્થના	૬૨
૩૭.	ભજન	૬૩
૩૮.	પૂજ્ય શ્રીમોટાનો છેલ્લો પત્ર	૬૪

શ્રીસદ્ગુરુ

શ્રીસદ્ગુરુ એટલે કંઈ શરીર નહિ તેમ તેની તેજસ્વી પ્રતિભા પણ નહિ. ગુરુ એટલે વિશ્વની પ્રત્યેક વस્તુનું કોઈ પરમ ચેતનશક્તિ સાથે શા માટે અને કેવી રીતે સંકળાવાનું બને છે, તે સમજાવનાર જ્ઞાનશક્તિ.

સદ્ગુરુ કંઈ માટીનું પૂતળું નથી, પરંતુ ચેતનનું લાક્ષણિક અંગ છે

સદ્ગુરુને માત્ર જાણવાથી કે તેમની સાથે માત્ર રહેવાથી આપણું કશું દળદર ઝીટી શકતું નથી.

સદ્ગુરુ કે ઉત્તમ પ્રકારના આત્મનિષ જીવમાં સામાન્ય જીવથી એટલે કે જીવદશાવાળા માનવીથી રાગ થવો એ પણ એક દુર્ઘટ ઘટના છે.

સદ્ગુરુનું શરીર એ આપણું સાધન નથી. આપણું સાધન તો સદ્ગુરુની ભાવ-ચેતનાશક્તિ છે.

સંસ્કાર

જે જે પ્રકારનાં વિચારો, વૃત્તિઓ, વલણો આપણા મનમાં ઊગ્યાં અને તેની પરંપરા પ્રગટી તો નક્કી સમજી લેજો કે તે પ્રકારના સંસ્કાર પડી ચૂકવાના જ, તેવા સંસ્કારનું પરિણામ પણ તેવું જ છે, તે પણ નક્કી.

સંતસમાગમના સંસ્કારો આજે નહિ તો કાલે જાગ્યા વિના રહેવાના નથી. સત્સંગની સોબત ઊર્ધ્વ પ્રકારના મનન ચિંતવનમાં રખાવે, તેથી ચિત્તમાં પડેલા સંસ્કારોનું જોર ચાલતું નથી.

ચિત્ત ઓપન કેમેરા છે, એમાં બધું સંગ્રહાઈ જાય, એને કહે છે, ‘આપણા સંસ્કાર’. એ સંસ્કાર ચિત્તમાં પડ્યા, એ કાળે કરીને ઉદ્ય વર્તમાન થાય. ઉદ્ય વર્તમાન એટલે કે અંદરથી ઊછળીને બહાર આવે એટલે એને વૃત્તિ કહે. એ વૃત્તિ બહાર આવી એટલે ઓક્ષનમાં મુકાય. એ કર્મનું મૂળ. કર્મનું મૂળ આ.

વિચાર

યોગ્ય વિચારોમાં એટલી સર્જકશક્તિ છે કે તે ધાર્યું પરિણામ લાવવા માટે અનુકૂળ પરિસ્થિતિ ઉપજાવી શકે છે. વિચારોમાં એવું પ્રાબલ્ય હોય છે કે તે જીવનમાં આચારમાં ઘણો ફેરફાર કરી મૂકે છે.

આપણે જ વિશ્વ છીએ અને આપણામાં જ સારુંય વિશ્વ વસેલું છે. આપણે જે રીતે વિચાર કરીએ છીએ તે જ રીતે તે ફરીને પાછા આપણામાં પેસતા હોય છે. એટલે નકારાત્મક વિચારો જેટલા ઓછા થાય તેટલું વધારે સારું, નહિ તો પાછા એ વિચારો બેવડા જોરથી-બેવડી ગતિથી આપણામાં પેસવાના છે, અને આપણને વધારે નુકસાન કરશે.

વિચારથી પ્રકટેલી સમજણ જુદી છે, ભાવનાથી પ્રકટેલી સમજણ જુદી છે અને વર્તનમાં મુકાયેલી સમજણ જુદી છે. વિચાર, ભાવના અને

વર્તન એ ગ્રાણોનો સુમેળ આપણે કરવાનો છે. વિચાર કંઈક હોય, ભાવના કંઈક હોય અને વર્તન કંઈક હોય એવું બેહૂં અને કઢંગું જીવન લોકો તો જીવી રહ્યા છે.

કોઈ વિચારો હઠે નહિ ત્યારે તેના ઉપાયોનો માર્ગ લેવો, મોટેથી નામસ્મરણ કરવું, ભગવાનને પ્રાર્થના કરવી, કોઈ પ્રિય ભજનનું રટણ-મનન ચિંતવન કરવું કે જે સત્પુરુષમાં લગની લાગી હોય તેનું સ્મરણ કર્યા કરવું.

ગમે તેટલા જોરથી કોઈ વિચારો આવતા હોય તોપણ એને એટલા જ કે વધારે જોરથી અટકાવવાનો પ્રયત્ન કરવો નહિ. જો આપણે વિચારોના ધસારાને એવી રીતે અટકાવીશું તો એ તાત્કાલિક કદાચ અટકી જાય, કિંતુ તેથી આપણું કામ સુધરશે નહિ. આપણે તો ત્યારે એને સમજવા મથવું. એ કેમ આવે છે, શાથી આવે છે, એનું

મૂળ શું છે, તે બધું આપણે જોવું અને એમ આપણે એનામાં ઊરું ઉત્તરવાનું રાખવું.

તમે માત્ર વિચારોને જોયા કરો. આપણે એટલો જ અત્યાસ પાડીએ અને બીજું સ્ટેપ એ છે કે તમે એની સાંકળ ન જોડો. આ તો ત્રીજું સ્ટેપ છે, તે સાક્ષીની સ્થિતિ વધે. એ પછી તમારામાં કોઈ પણ જાતની વૃત્તિ જગીને વહેવા માંડે ત્યારે તમે એ જોઈ શકો કે આ વિધેયાત્મક છે કે નકારાત્મક એવી વિવેકશક્તિ એમાંથી જાગે છે, પછી તમે એનો ઈન્કાર કરી શકો છો. એટલું બળ એમાંથી ગ્રાપ્ત થાય છે.

કોઈ આપણા વિશે ગમે તેવું ધારે કે વિચારે તેમ છતાં, આપણે તેના વિશે ઉત્તમમાં ઉત્તમ રીતે વિચારીએ તે આપણા પોતાના જીવન વિકાસ કાજે ઉત્તમમાં ઉત્તમ છે.

પ્રાણ

આપણે વિચારીએ તો બુદ્ધિ અને પ્રાણ આ બે જ તત્ત્વ આપણામાં કામ કરે છે. વિચારવાનું કામ જે કરે તે બુદ્ધિ છે. અને જે બધી કિયા થાય છે તે પ્રાણ છે.

આપણાં મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને અહમૃ જે છે એમાં પ્રાણ મોખરે છે. પ્રાણતત્ત્વમાં જ આશા, ઈચ્છા, તૃષ્ણા, લોલુપતા, લોભ, મોછ છે. જે બધી કિયા થાય છે તે પ્રાણ છે. કામ, કોધ, મોછ, મદ, મત્સર, ખાવુંપીવું, ગમા-અણગમા, રાગદ્વેષ આ બધું પ્રાણતત્ત્વને લીધે છે. સંસારવ્યવહારમાં બુદ્ધિ કરતાં પ્રાણતત્ત્વ આગળ છે. એટલે આધ્યાત્મિક માર્ગ જવું હશે તો પ્રાણતત્ત્વને મોળું પાડવું પડશે અને બુદ્ધિને મોળી પાડવી પડશે. જવદશામાં આપણું સંચાલન

પ્રાણથી થયા કરતું હોય છે. એટલે પ્રાણ મોખરે હોય છે. (પ્રાણને જગાડવા માટે બર્નિંગ ડિઝાઇન થવી જોઈએ.) ભજન દ્વારા, સ્મરણ દ્વારા, દિવસના અમુક કલાક એકના એક વિષયમાં રોકાયેલાં રહીએ તો પ્રાણ એની મેળે ભણે છે. પ્રાણ ભણ્યા પછી મનન ચિંતવનમાં રસ પડે.

ઉર્ધ્વ બાજુનો પ્રાણ થાય ત્યારે સ્વાર્થ ઘટે, કામ, કોધ, લોભ, મોહ વગેરે ઘટે. માલિકી ભાવ મોળો પડતો જાય છે. ઉર્ધ્વ પ્રકારનો પ્રાણ થાય એમ ગુણ અને ભાવ વધે. સાહસ, હિંમત, તટસ્થતા વધે. આ બધા ગુણોનો વિકાસ થાય.

અહમુ

આપણામાં રહેલા અહમુતત્વના ઉધ્વકરણા
માટે, તેને સાત્ત્વિક બનાવવા માટે આપણે એને
જબરજસ્ત આધાતો આપવા જ પડશે. તે માટે
આપણને જે ન ગમતા હોય તેવાને પ્રેમથી મળવું,
એમનું કામ કરી આપવું અને એમનો પ્રેમ
સંપાદન કરવાનો રાખવો. આપણને જેની સૂગ
હોય એને પહેલું ભેટવું અને તે પણ અંતઃકરણના
ઉમળકાથી. જેને જેને ખરાબ ગણતા હોઈએ,
પછીથી તે માણસ હોય કે એની વૃત્તિ હોય,
એનો કદી તિરસ્કાર કરવો નહિ. એને માટે
દિલમાં પ્રેમ રાખી, જો પ્રસંગ આવે તો તટસ્થતા
અને સહાનુભૂતિની વૃત્તિથી તથા આપણને પડેલી
ટેવને સુધારવાને કાજે સાધન તરીકે તે તકનો
ઉપયોગ આપણે કરવાનો છે.

બુદ્ધિ

ઉત્કટ જિજ્ઞાસા એ પહેલી હકીકત, બીજી હકીકત સદ્ગુરુ, ત્રીજી હકીકત છે, આપણા પોતાના ચકોર અને મુક્ત થતાં જતાં બુદ્ધિ અને ભાવ. સાધકની મુક્ત થતી જતી બુદ્ધિ એટલે શું? એમ પ્રશ્ન થાય, બુદ્ધિ બે પ્રકારની છે એક બુદ્ધિ તો અનેક પ્રકારની સમજણો, ટેવ-કુટેવોથી યુક્ત અને અનેક જાતના પાસાથી રંગાયેલી એ તદ્દન જીવ પ્રકારની નિભન્ન પ્રકારની બુદ્ધિ છે. બીજા પ્રકારની બુદ્ધિ, જેમાં સત અસતનો વિવેક જાગેલો છે અને જેનો જુદી જુદી અનેક પ્રકારની સમજણોથી છુટકારો થતો જાય છે. એવી બુદ્ધિ એ બીજા પ્રકારની બુદ્ધિ જ-આ માર્ગમાં ઉપયોગી છે. પહેલા પ્રકારની બુદ્ધિ જીવને આ માર્ગમાં ઘણી ઘણી નડતરરૂપ છે.

સ્વભાવના પૂર્થકરણની પણ ઘણી જરૂર છે. બુદ્ધિમાં સ્વતંત્રતા છે એમ જે માનીએ છીએ તે પણ એક પ્રકારનો ભ્રમ છે. અનેક પ્રકારના જુદા જુદા પૂર્વગ્રહોથી બુદ્ધિ રંગાયેલી છે. બુદ્ધિમાં અનેક પ્રકારના સંસ્કારોની સમજણો, માન્યતાઓ વગેરે પડેલું છે.

શુદ્ધ, સાત્ત્વિક થયેલી બુદ્ધિ સંપૂર્ણપણે પક્ષપાત વિનાની થઈ ગયેલી હોય છે, જે પૂરેપૂરી નિષ્પક્ષપાતપણાની હોય છે અને સંપૂર્ણ સમત્વયુક્ત હોય છે. શાંતિની દશા તે વેળા જીવતી થયેલી બુદ્ધિમાં પ્રવત્ત્યા કરતી હોય છે. પોતાનાથી પરદશામાં જે પ્રેરણાત્મક સમજણો પ્રકટ્યા કરે છે, તેને તે અસલ મૂળ ધર્મના સ્વરૂપમાં સ્વીકારી શકતી હોય છે, એટલે આવા પ્રકારની બુદ્ધિ મન દ્વારા પ્રાણને સંપૂર્ણ શુદ્ધ

કરાવવાને શક્તિમાન બની શકતી હોય છે.

બુદ્ધિનો ઉપયોગ આપણી તમજ્જા કેમ વધુ
વધે એ તરફ તેને દોડાવવામાં, આપણી આગળ
પાછળના વાતાવરણમાં જે કંઈ બનતું હોય
તેમાંથી પણ જીવનધ્યેયના માર્ગને અનુકૂળ સાર
ખેંચી કાઢવામાં, પ્રેરણા મેળવવામાં તે બધાનું
નિરીક્ષણ કરી તેનું પૃથક્કરણ કરી જે કંઈ પ્રતિકૂળ
હોય તેનો ત્યાગ કરી આપણી બુદ્ધિનો જ્ઞાનપૂર્વક
ઉપયોગ કર્યા કરવાનો છે.

બુદ્ધિમાં સમતા પ્રગટે એનું નામ યોગ છે.

આપણા આધારમાં ચેતનનું કોઈ નજીકમાં
નજીક અંગ હોય તો તે બુદ્ધિ છે.

જેની બુદ્ધિમાં શરણાગતપણું પ્રગટ્યું છે તેને
પછી તો જીવનના સર્વ કોઈ ક્ષેત્રમાં પ્રભુનો ભાવ
જીવતો રાખ્યા કરવાનું શક્ય બનતું હોય છે.

દલીલબાળ બુદ્ધિની એક જાતની ખંજવાળ છે. અનેક પ્રકારનાં આવરણોથી આપણી બુદ્ધિ આચળાદિત થયેલી છે.

બુદ્ધિ મદદકર્તા છે અને અકલ્યાણકર્તા પણ છે. બુદ્ધિ જ્યાં દેખી શકતી નથી ત્યાં પણ તે બોધ કરવાને પ્રેરાય છે.

મન

સંસારને છોડ્યો છોડી શકતો નથી. સંસાર આપણને વળગેલો નથી, કિંતુ આપણે સંસારને વળગેલા છીએ અને તેથી કરીને આપણે મનની સ્થિતિને જ ત્યાં માત્ર પલટાવવાની રહે છે. મન એની મેળે પલટી જઈ શકતું નથી, એટલા કાજે જ સાધનાની જરૂર છે. મારી તમને હૃદયની પ્રાર્થના છે કે મનને પલટાવવા કાજે પ્રભુના નામનું પ્રેમભક્તિજ્ઞાનપૂર્વકનું સતત એકધારું સ્મરણ એ એક મુખ્ય સાધન. બીજું સાધન તે રોજબરોજનાં થતાં સકળ કર્મોમાં શ્રીભગવાનની ભાવના અને ધારણા જીવતી રહે તે કાજેનો દૃઢતાભર્યો અભ્યાસ અને ગીજું સાધન તે જીવનમાં મળતા સર્વ પ્રસંગોમાં સમતા, શાંતિ, ધીરજ, તટસ્થતા, બીજાઓ પરત્વેની સહાનુભૂતિ વગેરે ગુણો આપણે કેળવતા રહેવાનું છે.

મનમાં વિચાર ઉठે તે વિચારના સ્વરૂપને અને તેના મૂળને ઓળખતા આપણે શીખવું પડશે અને તેમ જાણીને તેનું જ્યાં જ્યાં નકારાત્મક સ્વરૂપ હોય એટલે કે જીવ સ્વભાવવાળું વલણ હોય તેને ત્યજવાનાં ભારેમાં ભારે હિંમત અને સાહસ આપણે કેળવવાં પડવાનાં છે. એમ પ્રત્યેક વિચારના સ્વરૂપને અને તેના મૂળને જો પારખવાની હૃદયની કળા પ્રાપ્ત થઈ ગઈ તો તેમાંથી આપણાને ઘણું ઘણું મળવાનું છે, બણ અને પ્રેરણા પણ. આપણે આપણા મનની સાથે ખેલ કરવાનો છે અને સાથે સાથે એની મદદ પણ લીધા કરવાની છે.

મન અને એની શક્તિ અપાર છે અને એની કુશળતા પણ, જો આપણે ચાહીએ અને નિશ્ચિત ને નિશ્ચિત થઈ જઈને રચનાત્મકપણે તેની મદદ લીધા કરીએ તો મન આપણું મિત્ર છે. મનની

શક્તિ એ કંઈ જેવી તેવી નથી. સર્વ કંઈ જતી લઈને એના મય થઈ જવાની એનામાં શક્તિ છે.

નકામી નકામી વાતોમાં કદાપિ મનને પરોવવું નહિ. કોઈ તેવી વાતો કરતું હોય તો તે ભલે કરે. આપણે તેમાં રસ લેવો નહિ.

જે કોઈ પોતાના મનને ટકોરે છે, એને વારંવાર સંકોરે છે તે એકની એક દશામાં પડી ન રહી શકે, તેને નવું ને નવું સૂજયા કરે, તેને ઉકેલ પણ જરૂર અને તે પ્રમાણે વર્તવાની સૂજ પણ પડે.

મનની સાથે ઝઘડયા વિના સાધકનો કદી આરો આવવાનો નથી. સ્વભાવને પલટાવવાનો છે અને તેમ કર્યા વિના યમુનાની ગતિ ઊલટી થઈ શકવાની નથી.

ધ્યેય

તમારી સામે એક ધ્યેય હોવું જોઈએ. એ ધ્યેય દફ્તાપૂર્વકનું, મક્કમતાપૂર્વકનું, નિશ્ચયપૂર્વકનું, મરણિયા ટેક જેવું હોવું જોઈએ, ગમે તે થાય, પણ આ તો કરવું, કરવું ને કરવું જ છે એવું પાકું ધ્યેય થતું નથી ત્યાં સુધી કંઈ કશું આપણામાંથી જવું અશક્ય.

ધ્યેય બહુ ઓછા માણસોમાં હોય છે. માણસોને ઐહિક જીવન વિશે પણ ધ્યેય હોતું નથી. લોકો રગણિયા ગાડાની પેઠે ગમે તેમ જીવે છે. એટલે ગમે તે કોઈ પ્રકારનું જીવનમાં ધ્યેય રાખો. ધ્યેય વિનાનું જીવન નકામું છે. ધ્યેયને કારણે તમને જે એકાગ્રતા થશે તે એકાગ્રતા તમને ઉર્ધ્વમાં લઈ ગયા સિવાય રહેશે નહિ.

ધ્યેય હોય એની એકાગ્રતા આવે. એ એકાગ્રતા પછી સ્ટેટિક (સ્થગિત) નથી રહેતી. એ પ્રસરે છે. એ તમને ઉર્ધ્વમાં લઈ જાય છે.

ઉર્ધ્વ જીવન તરફ એકાગ્રતા જ્યારે વળવા લાગે છે ત્યારે જરા ઉચે જતાં જતાં એ સભાનતા જાગે છે, પછી એ તલપાપડ થાય છે, તલસાટ થાય છે. એ તલસાટ કરતાંય પણ વધારે તલસાટ એને બીજા કોઈ વિષયમાં જવા જ ના દઈ શકે, પણ તે જરવી શકાય તેવો નથી હોતો. આપણું શરીર એને માટે લાયક બનેલું નથી હોતું, એ તલસાટમાં કેટલાકનું શરીર તૂટી પડે છે એવો તલસાટ હોય છે.

જીવન કોઈ ધેવાળું જીવીએ છીએ, તેનું પ્રત્યક્ષ લક્ષણ પ્રસન્નતા છે. અને પ્રસન્નતા જીવનમાં પ્રકટે છે ત્યારે જીવનમાં મુશ્કેલી લાગતી નથી. મુશ્કેલી સરળતાથી ઉકલે છે.

પ્રાર્થના

મનને સ્વચ્છ, શુદ્ધ રાખવા માટે પ્રાર્થના એ એક ઉત્તમ સાધન છે, જેમ પાણીમાં કપડાં અને શરીર ધોવાથી તેનો મેલ જતો રહે તેમ ઈશ્વરને અંતઃકરણથી પ્રાર્થના કરવાથી મનનો મેલ જતો રહે છે.

કંઈક કશું થતાં પ્રાર્થના કરવી. પ્રાર્થના તો કામ કરતાં કરતાં પણ થઈ શકે છે. જગતને સ્વચ્છે પણ ઘ્યાલ નથી તેના કરતાં ઘણું બધું પ્રાર્થનાથી સધાય છે.

સવારસાંજ નિયમિત પ્રાર્થના કરવાનું રાખવું. ઓછામાં ઓછી ત્રાણ વખત-રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠતી વખતે તથા બીજો એક સમય એમ પ્રાર્થનાના સમય નક્કી કરી રાખવા.

ખાલી ખાલી મોઢેથી પ્રાર્થના બોલવાથી તેવી પ્રાર્થનાનો ઉઠાવ અને રણકાર કદી પણ ઊઠી

શકતો નથી. ભારોભાર વેદના પ્રકટ્યા વિના પ્રાર્થનામાં આર્તનાદ ક્યાંથી પ્રકટે ?

પ્રાર્થના વખતે ચિત્ત કે લક્ષ હૃદય પર રાખવું.
પ્રાર્થના પાછળનો હેતુ શો છે ? તો કે આવી રીતે વારંવાર નિવેદન કરીએ, પ્રાર્થના કરીએ તો એની સાથે સાઈકીક કોન્ટેક્ટ (ચૈતસિક સંબંધ) જોડાય છે. હવે દિવસમાં પચાસ સાઠ વાર થાય. એનો અભ્યાસ થતાં તો ઘણી વાર થાય છે. એની સાથે એક લિંક (કડી) જોડાવાને માટે પ્રાર્થના તો બહુ જ મોટું સાધન છે. પ્રાર્થનામાં ધીરે ધીરે ઊંડાણ થાય છે અને ભાવ વધે છે. ત્યારે એ પ્રાર્થના કરવાથી ઘણા બધા હળવા થઈ જઈએ છીએ.

નામસ્મરણ

જ્ય ટૂંકામાં ટૂંકો હોવો જોઈએ. શબ્દ ત્રણ
ઠેકાણેથી ઉદ્ભવે-નાભિ, કંઠ, મૂર્ધન્ય. આ
ત્રણેયને ભેટે એવો શબ્દ ‘ઉં’. ઊંકારમાં એકલી
પૃથ્વી નહિ, પણ સમસ્ત નભોમંડળ સમાયેલું છે.

જ્ય કે મંત્ર એકધારો હૃદયથી લેવાયા કરાતો
હોય તો તેથી જ્ઞાનતંતુઓ પ્રાણવાન TONE-
UP બને છે, તેથી સમતા-શાંતિ-સમતોલપણું
પ્રગટે છે, જ્યારે એવી શાંતિ ટોચ પર પહોંચે છે
ત્યારે શરીરના રોગ પણ નિવારી શકવાની
શક્યતામાં પ્રગટે છે.

નામસ્મરણ ભલે શુષ્ણતાથી થતું લાગે તો પણ
લીધા કરવું. સંતોષકારક ન થતું લાગે ત્યારે
આપણું મન બીજુ કોઈ બાબતમાં ભેરવાઈ પડેલું
છે એમ સમજવું.

નામસ્મરણનો હેતુ જ્ઞાનપૂર્વક હદ્યમાં હદ્યથી
જીવતો રહ્યા કરે તો જ તેનો અર્થ સરી શકે.
બાકી ખાલી નામ લીધા કર્યે કે ભજન-કીર્તન
ગાયા કર્યે કશો જ દહાડો ન વળે.

હરિ કરતાંય હરિનું નામ ચિહ્નિયાતું છે. નામથી
કરીને નામીનો પરિચય થાય છે. પહેલાં કંઈ
નામ લેવાથી પરિચય થતો નથી. નામ જેમ વધારે
ને વધારે ધૂંટાય પછી રસ પ્રગટતો અનુભવાય.
મૂળ નામી છે એ તો ઓઝ્સ્ટ્રેક્ટ છે. નામ જ
ધૂંટાવું જોઈએ એવું કંઈ નથી. સામાન્ય માણસને
આશરો લેવા માટે નામ છે. પણ નામનો ભાવ
પ્રગટ્યો એ ભાવ જાગે તો એ ભાવ સાતત્ય વડે
કરીને એ નામીનો પરિચય આપણાને થાય છે.
માટે નામ મોટું કહેલું.

મનનચિંતવન

સત્પુરુષનું કે સદાત્માનું ચિંતવન કે મનન તે આપણને તેની ચેતનાની તો કોઈ કંઈ કશી ગતાગમ હોતી નથી, પણ તેના અંગેના વિચારો, તેના લખાણનું વારંવાર વાંચન અને તેનું મનન જો મનમાં થયા કરે તો તે બીજા પ્રકારના સ્થળ વિચારો કરતાં વધુ ઉત્તમ છે.

મનન એટલે મનમાં મન વડે કરીને પ્રભુની સ્મરણભાવનામાં જ્ઞાનપૂર્વક એકાકાર રહેવાય એમ સતત એકધારું મથ્યા કરવું તે. ચિંતવન એટલે પળેપળ જીવનવિકાસના આદર્શની સામે જ નજર રહ્યા કરે એવી માનસિક એકાગ્રતા, માનસિક પ્રવૃત્તિમાં આમથી તેમ ફેંકાવાનું થતાં પાછું મનને સ્થિર કરીને એને આદર્શના કેંદ્રમાં પાછું ખેંચી આણવું તે. આવી પ્રક્રિયા સાધકે જાગૃતિ સેવીને વારંવાર કરવાની છે.

કર્મ

જવ પોતાને કર્મનો કર્તા માને છે, પરંતુ વાસ્તવિક રીતે તો કર્મ થવાને કાજે જવ એ તો ગૌણ કારણ અને કરણ છે. કર્મ બનવાનાં કે થવાનાં ઘણાં કારણો અને કરણ છે, તેથી કર્મનો આધાર એકલા જવ પર રહેલો નથી.

જવન તેના ઉત્તમ પ્રકારના વિકાસમાં પ્રકટે એના કાજે કર્મ એ તેના ઘડતર કાજે ઘણું મહત્વનું અંગ છે. કર્મ વડે જ માનવીનું જવન ઘડાતું હોય છે. કર્મ વડે જ અનેક જવોની સાથે સંબંધમાં અવાય છે. કર્મથી જ ગુણ, ભાવ, શક્તિ, સમજણ, આવડત, કૌશલ્ય વગેરે વગેરે ખીલે છે.

કર્મની ભૂમિકા પર ભક્તિ થાય તો બરોબર. કર્મ અનિવાર્ય છે. જો માણસ એકલી ભક્તિ કર્યા કરતો હોય તે બરાબર નથી. ભજન કર્યા કરે અને સાંસારિક જવાબદારી સ્વીકારે નહિ તો

એ બરાબર નહિ કહેવાય. મળેલું કર્મ હોય તો તેની જવાબદારી તો એણે સ્વીકારવી જ જોઈએ.

અજ્ઞાનમાં રહીને થતાં જતાં કર્મ તે કર્મ જ ન કહેવાય, તેમ જ અહમૃતાથી કરીને જે કર્મ થતાં જતાં હોય તે પણ કર્મ ન ગણાય.

કર્મ કરતી વખતે આપણને મોહ ન રહે. પ્રભુ પ્રીત્યર્�ે કરીએ. એટલે કે અહમૃતભાવ ધીરેધીરે ઓછો થાય એ આપણું ધ્યેય રહેવું જોઈએ. સંસારનાં કર્મ કરવાનાં ખરાં. જે ભાગે આવ્યાં હોય એ ઉત્તમમાં ઉત્તમ રીતે કરવાનાં ખરાં. એમાં અહમૃતભાવ ન રહેવો જોઈએ. એ ઈન્ટેલેક્ચ્યુઅલ કન્સેપ્શનમાં અને એજવેલ એજ ઈન ઓક્શન હોવું જોઈએ. એમાં મમત્વ, કામના, જંખના ન રહેવાં જોઈએ.

અંતર્મુખતા

અંતર્મુખતા કેળવવાનું કર્યો કરીએ કે કર્યો કરતા હોઈએ તો આપણો આપણામાં જ બસ ગુલતાન રહ્યા કરીએ. બીજા જીવમાં મન તણાયા કરવાનું ઓછામાં ઓછું બને. જે જે પળે જેમ જેમ જે જે પ્રકારનું મનમાં ઉઠે તે તે બધું આપણા અસલ સ્વરૂપનું નથી એમ દઢ વિચારી વિચારીને પણ મનથી તે તે પળે આપણો અલગ બનતા રહેવાનું છે.

અંતર્મુખતામાંથી સ્વશક્તિનું જ્ઞાન આપણી ઈદ્રિયો, વૃત્તિઓ, મનાદિકરણ વગેરેને જેમ જેમ જગતપણે સમજવા મથ્યા કરીશું તેમ તેમ આપણને આપણું સ્વરૂપ કેવું છે તે સમજાયા વિના રહેવાનું નથી.

જીવનની દણ્ણિ અને વૃત્તિ જગતમાં બહિર્મુખપણે સંકળાયેલી રહેલી છે. તે બધી સંકેલી લઈને અંતર્મુખપણામાં વાળવાની રહે છે.

અંતર્મુખ જેણે થવું છે અને ભગવાનને શરણે
રહેવું છે તેણે ચેતનાનિષ સાથે સંપર્ક રાખવો
જરૂરી છે અને વધારે ને વધારે અંતર્મુખતા
પ્રગટાવવાની છે.

અંતર્મુખ થવાને સત્પુરુષનો માર્ગ સર્વ દુઃખ
ક્ષયનો ઉપાય છે. તે સમજવાનો અવસર
એકમાત્ર આ મનુષ્યદેહ છે.

અંતર્મુખ દાણિ રાખીશું અને મનનો જે હેતુ
રાખીશું તે પ્રમાણે આપણા પર કાર્યની અસર
થશે. પોતાનું સ્વરૂપ કેવું છે તે જાણવાનું છે.
ત્યાં બધું પલટાવવામાં કશુંયે બાકી ન રાખો.

આત્મનિવેદનનો અભ્યાસ જેમ જેમ દફળણે
કેળવાતો જાય તેમ તેમ તે વધારે ને વધારે
અંતર્મુખ બનતો જાય છે.

સંયમ

સંયમ એટલે પોતાના જીવનનું સંપૂર્ણપણે રક્ષણ કરવા યોજાયેલી આચારની દીવાલ, સંયમમાં પોતાની પ્રત્યે કઠોરમાં કઠોર થવાનું હોય છે, સાચો સંયમ અંતરમાં જ સમાઈને રહે છે. તે સાથે સાથે અંતરમાંથી બળ પ્રકટાવીને જીવનના પ્રત્યેક આચાર વિચારની તે ચોકી પણ કરે છે.

સંયમ એ તો સાધુપુરુષનો, સજ્જનનો શાશગાર છે અને સંસારીઓનો તો તારણહાર છે.

પ્રાણવાન ચેતનવાળો સંયમ મથતાં મથતાં પ્રકટે છે. આવો સંયમ નીતિ કે સદાચારના ‘સંયમ’ કરતાં ક્યાંય ચઢિયાતો અને ઘણા ઊચા પ્રકારનો છે. એને ‘સંયમ’ કરતાં કોઈ બીજા શર્ષણથી ઓળખાવવો ઘટે.

સંયમનું કવચ અત્યંત આવશ્યક છે. તેવાના જીવનના બાહ્યાચારમાં એના અંતરના સંયમની છાપ સરખી પણ તે નહિ પડવા દે એવો એ સાચો સંયમી છે, જે સંયમને વારંવાર વ્યક્ત થવાપણું હોય છે, તે સંયમ જ નથી.

પાર્થિવ સંયમની ભૂમિકાને હજુ આપણે વટાવી શક્યા નથી, પરંતુ આપણી સમજમાં રહે ખરી કે સંયમની કસોટી તો આગળ છે. સ્થૂળ જેવી વાસનાઓને આપણે વધારે જલદીથી જીતી લઈને આપણા સંયમને આપણે વધારે સૂક્ષ્મ બનાવ્યા કરવાનો છે.

જાગૃતિ

જાગૃતિની પણ ઘણી જરૂર છે. આને હું ‘જાગૃતિયોગ’ એવું નામ પણ આપું. જેને જે પ્રકારની જાગૃતિ જેમાં જેમાં પ્રગટે તેમાં તેમાંથી તેને તેવી તેવી સમજણ પ્રગટે છે.

જાગૃતિ વિશેષ ને વિશેષ ચેતનવંતી અને સતેજ બન્યા કરે છે તેમ તેમ એવા પ્રકારની ભાવાત્મક ચેતનવંતી જાગૃતિ આપણો શ્રીસદ્ગુરુ બની જતી હોય છે.

જાગૃતિ જ્યારે બુદ્ધિમાં જ્ઞાનપૂર્વકની પ્રગટે છે ત્યારે જીવનમાં ઉપજતા અનેક જાતના પ્રશ્નોના ઉકેલને તે તુરત સુઝાડી દે છે. જાગૃતિની ભાવના વધારે ને વધારે સતેજ બનતી જતી હોય છે તેમતેમ બુદ્ધિમાં સમતા પણ પ્રકટતી અનુભવાય છે.

આપણામાં જાગૃતિ આપોઆપ કે સહજ નથી તેવું જો સમજાય તો બીજા પ્રકારે તે મેળવવી

રહી અને તે પણ બની શકતું ન હોય તો કોઈ
અનુભવી ઉચ્ચાત્મા (શ્રીસદ્ગુરુ)નું પ્રેમભક્તિ
અને શ્રદ્ધાવિશ્વાસથી શરણું પકડવું.

જાગૃતિ રાખ્યા વિના આપણે એક ડગલું પણ
આગળ ભરી શકવાનાં નથી. જાગૃતિ રાખ્યા
વિના કરેલાં કામોની આપણાને કશી ખબર પણ
પડવાની નથી.

જાગૃતિપૂર્વક પ્રભુકૃપાથી મથાયા જવાય. જે
જે કંઈ જીવદશાનું હોય કે પ્રગટે તેનો જે
જાગૃતિથી તેને તે પળે ઈન્કાર થયા જાય અને
મનાદિકરણ ભાવનામાં એકાગ્રતાથી રમ્યા કરતાં
અનુભવાય, કંઈ કશા વમળમાં મનાદિકરણ
ડૂબેલાં ન રહે અથવા ડૂબતાં હોય તે વેળા
જાગૃતિથી ચેતી જવાય. તે વેળાથી સાચી
સાધનાની શરૂઆત થાય.

જંખના

જે ભગવાનને જંખે છે અને એવા જંખવાપણામાં જેનું હૃદય ભળોલું છે, તેના જીવનના સર્વ પ્રસંગોમાં તેનો ભગવાન નવનિર્માણ પ્રગટાવે છે. આવી વેળાએ જે જીવ શ્રીભગવાનનો વરદ હસ્ત હૃદયમાં પ્રેમભક્તિથી કરીને પકડી રાખે છે, એવા જીવનું ઊચા આવવાપણું જરૂર બને છે.

આપણે જંખનાને સચેત અને સજીવન રાખવા પ્રાણની વાસનાઓની આહૃતિઓ આપ્યા જ કરવાની છે. જેમ જેમ આપણી પ્રાણશુદ્ધિ થતી જશે અને એવા પ્રકારના ખરેખરા સાચા હૃદયના એકધારા પ્રયત્નમાં આપણે પૂરેપૂરા પ્રેમથી જેમ જેમ મંડ્યા કરીશું તેમ તેમ તેવી તો ગગનચુંબિત જંખના પ્રગટવાની છે.

નિશ્ચય

જીવનવિકાસ પરત્વેના સંકલ્પને દઢ કરતાં જ રહેવું. જેનો નિશ્ચય દઢ અને જીવંત હોય તેનું મન કશે આમ કે તેમ ફેંકાઈ ના શકે. નિશ્ચયી હોય કે રહે તે તો સદાય જીવતો રહી શકે. તે કદી ચળી કે ડગી પણ ન શકે. નિશ્ચય એટલે જીવનધ્યેય પરત્વેનાં દણ્ઠિ, વૃત્તિ, વલાણ આદિને તેની ગતિમાં એકાગ્ર, કેંદ્રિત અને ભાવમય રહ્યા કરવાની દશા જેમાં પાક્યા કરે છે તે. જીવનના રચનાત્મક વલાણ માટે કરેલા નિર્ણયને તો મૃત્યુ આવે છતાં વળગી જ રહેવાનું.

સાધના પરત્વેનો મક્કમ નિશ્ચયાત્મક મન-બુદ્ધિ-પ્રાણથી થયેલો નિર્ધાર હોય તો તેથી સાધનામાં વધારે વેગ મળે છે. નિશ્ચય દઢ અને જીવંત હોય કે રહે તો તે (નિશ્ચય) સદાય જીવતો રહી શકે.

સંકલ્પ

દઢ સંકલ્પબળ કેટલું કામ કરે છે અને જીવનને તે કેટલું અને કેવું ધરે છે તે તો એવો દઢ સંકલ્પ જે જીવે કેળવ્યો છે તે જાણો છે. જેણો જીવનના ઉચ્ચ માર્ગ પ્રયાણ કરવાનું છે એવા જીવે એવો દઢ સંકલ્પ કરવો તે જરૂરી છે.

આપણો જે નવું જીવન નિર્માણ કરવા માગીએ છીએ તેમાં સંકલ્પનું બળ તેવા પ્રકારનું જન્માવતાં રહીશું તો જે તે બધું તે પ્રકારનું થયા કરતું રહેશે.

આપણા વિચારોની અસર, આપણી વાસનાઓની અસર પણ આપણામાં તો બધે ફેલાય છે જ તેમ બીજે પણ ફેલાય છે. કોઈ પણ વિચાર કે લાગણી સંકલ્પ વિના ઉઠવી સંભવિત નથી એટલે સંકલ્પશુદ્ધિ એ પણ આપણી એક મહાન સાધના છે.

તटस्थता

જે વિચાર, વૃત્તિ, લાગણી, ભાવના વગેરેના હુમલા પ્રગટે ત્યારે તેની સાથે તદાકાર અને તદ્દૂપ ન થઈ જવાય અને જેના વડે કરીને તે બધાંમાંથી અળગા રહી શકાય તેનું નામ તટસ્થતા અને સમતા.

આપણામાં ઊર્ધતી માલિકી હકની વૃત્તિમાંથી આપણે આપણું મન વિતરાગ કરવું જ પડશે. જે જે કંઈ કોમળ લાગણીઓ, વૃત્તિઓ, વિચારો, ભાવનાઓ, રસવૃત્તિઓ, વાસનાઓ, ઈચ્છાઓ, આશાઓ આપણામાં રહેલાં હોય કે જાગ્યા કરે એ બધાંને આપણે આપણાથી જુદાં ગણવાનું અને તે પ્રત્યે તેમ વર્તવાનું કરાવવું પડશે.

તટસ્થતાનો ગુણધર્મ આપણને બુદ્ધિથી સમજાવે કે ‘આમાં ભેળવાઈ ગયા. આ બરાબર ના કર્યુ.’

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ નથી તેવો જીવ કશું કરી શકવાનો નથી. જેણે ઉર્ધ્વમાર્ગ જવાનું છે તેવા જીવે જો લાચારીની વાત કરી તો જાણવું કે એમાં કશો આત્મવિશ્વાસ પ્રગટ્યો નથી. આત્મવિશ્વાસ તો લાચારીને ક્યાંયે ફગાવી દે છે. જીવની લાચારી એ તો એના મનની એક પ્રકારની છેતરામણ છે.

આત્મવિશ્વાસ કે શ્રદ્ધા પ્રગટતાં લાચારી ટકી શકતી નથી. શ્રદ્ધાનાં બળશક્તિ વડે જ જીવનનો વિકાસ થવાની શક્યતા છે.

આત્મવિશ્વાસના બળથી જ માણસ જે તે યોગ્ય કરી શકે છે. એટલે આપણે તો જે સાધન લઈને બેઠાં છીએ એમાંથી જ્યાં સુધી આત્મવિશ્વાસ ન પ્રગટી શકે ત્યાં સુધી તે સાધનનો અભ્યાસ ઘણો ઘણા જરૂરનો છે.

અભ્યાસ

અભ્યાસ એટલે કે આપણો જે ધ્યેય ધાર્યું છે તેનું સતત ચિંતન-અતિશય ભાવભરી રીતે અને વેગપૂર્વક આપણામાં જાગૃત રહ્યા કરે તે.

જીવ પ્રકારની આપણી પ્રકૃતિ છે તે એની મેળે ઉર્ધ્વ પ્રકારની નહિ થાય. એનો અભ્યાસ પાડવો પડશે.

જે તે કંઈ અભ્યાસથી આવડે છે. અભ્યાસ વિના સાધનામાં પ્રાણ પણ ન પ્રગટે. અભ્યાસ દફ થતાં તેમાં હદ્ય પણ રેડાય અને સામેલ થાય. અભ્યાસથી કરીને એક પ્રકારની લઢણ જાગે છે.

પરમ તત્ત્વની અવેરનેસ કોઈ માણસને રહે નહિ. અભ્યાસ કરતાં કરતાં જ્યારે અમુક દિવસોનો વધારે ગાળામાં એ અભ્યાસ થાય ત્યારે એની અવેરનેસ આવે એ સિવાય ના આવે.

અભ્યાસથી જે લઢણ જગે તેમાં એક પ્રકારની ઘરેડ પણ થઈ જવા સંભવ ખરો. તેથી અભ્યાસમાં વારંવાર આપણો બુદ્ધિ વડે કરીને, કલ્યાણના વડે કરીને હદ્યની લાગણીઓ વડે કરીને ભાવનાનું ઉદ્દીપન વારંવાર કર્યા કરવાનું રહે છે.

અભ્યાસ રાખશો અને જો તે ચાલુ જવંત રહેશો, તો ભલે કશું ન બને પણ માત્ર જો જપ એકલો જ હદ્યમાં હદ્યથી પૂરા ભાવ સાથે કર્યા કરવાનો અભ્યાસ રાખશો તો તેવા સાધનથી પણ પરિણામ તો તે જ આવવાનું છે, પરંતુ ‘આ થતું નથી અને તે થતું નથી’ એમ દુઃખી થયા કરીએ તે તો મુદ્દલે યોગ્ય નથી.

વૈરાગ્ય વિનાનો અભ્યાસ હોય તોપણ અભ્યાસ થતાં વૈરાગ્ય જન્મી જાય છે અને વૈરાગ્યની ભૂમિકા પાકી થતાં અભ્યાસમાં ચેતન પ્રગટે છે. એટલે અભ્યાસ એ એક મુખ્ય ચાવી છે.

વैરाग्य

वैराग्य એટલે સંસાર સાર વગરનો છે, નકામો છે, આડે આવે છે, આ બધું મિથ્યા છે, ખોટું છે, સંસાર કચરો છે વગેરે વગેરે વિચારો નહિ. આવા વિચારો ખોટા છે. કોઈ પણ બાબતની આપણને આસક્તિ ન રહે, રાગ ન રહે, મન કોઈ પણ વાતમાં ચોંટી રહે નહિ એનું નામ વैરાગ્ય.

વैરાગ્ય વિનાનો અભ્યાસ હોય તોપણ અભ્યાસ થતાં થતાં વैરાગ્ય જન્મી જાય છે. મનને એકદમ થાળે પાડવું એ કામ અધૂરું છે. ભગવાન કહે છે, મનને ‘અભ્યાસ’ અને ‘વैરાગ્ય’ એ બેથી વશમાં લાવી શકાશે.

વैરાગ્ય એટલે દરેકમાં જ્યારે જ્યારે મન જાય ત્યારે ત્યારે એને એમાંથી પાછું ખેંચી આણવું તે.

આત્મનિવેદન

આત્મનિવેદનથી તો સમજણની નવી અંતરની આંખ જન્મે છે. જીવનવિકાસની સદ્ગ્રાહાવના પ્રકટે છે. મન તદ્દન હળવું, શાંત, નિરાંતવાળું અને નિશ્ચિત બને છે. પ્રેમલક્ષ્ણા ભક્તિમાં જેને આત્મનિવેદન કહે છે. આત્મનિવેદન કર્યા પછી મનનો ભાર હળવો થઈ જાય છે.

આત્મનિવેદનનો જીવતો અભ્યાસ કેળવ્યા કરવાથી પરસ્પર હૃદયનો સંબંધ જીવતો થતો હોય છે.

આત્મનિવેદન આપણો જે કંઈ કહેવું હોય અથવા વ્યક્ત કરવું હોય તે આપણી જ ભાષામાં આપણો તેવો ભાવ ધારણ કરીને કહ્યા કરીએ. એ વધારે ઠીક છે.

આત્મનિવેદનથી ભગવાન સાથેનો આપણો સંબંધ વ્યક્તિગત કરી નાખવાનો છે.

સમર્પણભાવ

જીવનસંગ્રહમાંથી મુક્ત થવાનો એકમાત્ર રામભાષ ઉપાય અંતરથી અંતરમાં શ્રીભગવાનને આપણા જીવનરથનો સારથિ બનાવી દઈ, તેનું ભાવનાથી દઢપણે સ્થાપન કરી જીવનનાં સર્વ કર્મોના આદિ, મધ્ય અને અંતમાં તેને તેના સંચાલકના ભાવમાં અને રૂપમાં નીરખ્યા કરી તેનાં ચરણકમળમાં સર્વ ભાવે અને સર્વ રીતે આત્મસમર્પણ કરવામાં જ રહેલો છે.

સમર્પણની ભાવના પૂરૈપૂરી કેળવાયા વિના અહ્મૃ કદી પણ ઓગળી શકતું નથી.

જીવનવિકાસના સાધકે તો તેવો પળેપળનો સમર્પણ યજ્ઞ એકધારો ચલાવ્યા કરવાનો છે. જે કંઈ થાય તે વખતે જ તરત તેને યાદ કરી ચરણે ધરી દેવું.

શરણભાવ

શરણભાવ કેળવાતો જાય છે અને આપણી જ રીતથી કામ લેવાવાના આગ્રહો ઘટતા જાય છે. ભગવાનના શરણથી ગમે તેવો દુષ્ટ માણસ પણ સુધરી જાય છે. જે કંઈ આપો તે અડધું ન આપશો. આપો તો પૂરેપૂરું એને ચરણે ધરી દેશો. એનામાં લેવાની અને આપવાની અખૂટ શક્તિ છે. એની શક્તિને કોઈ હૃદ નથી.

શરણભાવનાને સમજવી અને અનુભવવી એ બહુ મુશ્કેલ કામ છે. જીવનવિકાસને માર્ગ આપણી આંગળી પકડીને ઢોરી જનાર એવો સદ્ગુરુ મળ્યો હોય અને જેના વિશે શ્રદ્ધા, વિશ્વાસ, ભક્તિ જીવતાં જાગતાં થયા હોય એવા જ્ઞાનથી શરણાગત રહ્યા કરવું, એના જેવી કોઈ ઉત્તમ સાધના નથી.

ત્રાટક

ત્રાટકના શિક્ષણ માટે વચમાં લીલું વર્તુળ અને તેની આસપાસ વધતા જતા કંકણાકારના રંગોવાળું ચિત્ર લેશો. ફક્ત આંખો મિટમિટાવા દેવી નહિ. પાંપણો પણ ફરકવા દેવી નહિ. તદ્દન સ્થિર દાઢિ કરવી અને રાખવી.

આંખ ફરકતી હોય તો મનથી દઢ નિશ્ચયનું બળ ત્યાં લગાડવું. એમ કરી કરીને આપણે સંકલ્પશક્તિને જન્માવવાની છે અને એને સર્વોપરી કરવાની છે.

નિર્ણયમાં મક્કમતા કેળવવા માટે જીવનું દ્વિધાપણું મિટાવવા માટે અને ભાવમાં તલ્લીનતા પ્રકટાવવા માટે પણ આ સાધન મદદકર્તા નીવડે છે. ત્રાટકની સાધનામાં પૂરેપૂરું પરિપક્વપણું પ્રકટતાં જીવતો ‘સંયમ’ પ્રકટે છે.

શ્રદ્ધા

શ્રદ્ધા એ તો નગદ નાણું છે. જેમ નગદ નાણાં વડે કરીને ખપની ચીજ બજારમાંથી લઈ શકાય છે. તેમ ભગવાન પર શ્રદ્ધા પ્રસંગ પડ્યે આપણને જો ટહ્હાર ન બનાવી શકે તો એ શ્રદ્ધા શ્રદ્ધા નથી.

ભગવાનની શ્રદ્ધા કંઈ એકદમ કોઈ જીવમાં સોએ સો ટકા જીવતી થઈ શકતી નથી.

શ્રદ્ધામાંથી તો પરાક્રમ પ્રગટવું ઘટે છે. જે વિષયમાં જેને શ્રદ્ધા પ્રગટેલી હોય છે, તે વિષયમાં શ્રદ્ધા તે જીવને ચોંટાડી રખાવે છે. એવું છે શ્રદ્ધાનું લક્ષણ. આત્મવિશ્વાસ પ્રગટતાં એનામાં ધીરજ, સાહસ, હિંમત, બળ, સહાનુભૂતિ, સહનશીલતા, વિવેક આદિ ગુણો એનામાં પ્રગટતાં અનુભવી શકે છે.

એકાગ્રતા

નિર્ણયાત્મક અને નિશ્ચયાત્મક તથા એકાગ્રતાભર્યું દર વલણ જ્યાં સુધી જવનમાં પ્રકટતું નથી ત્યાં સુધી સાધનાના માર્ગમાં પ્રગતિ થઈ શકવાની નથી તે નક્કી જાણશો. ઘડીમાં આમ કે ઘડીમાં તેમ એ જાતની વૃત્તિથી મુક્ત થઈ શકતું નથી. એ વૃત્તિ સાધનાના માર્ગમાં વિકાસ માટે ઘણી બાધક છે.

મૌનએકાંત લેવાનો હેતુ તો લગની લગાડવાનો છે અને સાધનામાં વિશેષ એકાગ્રતા, કેંદ્રિતતા પ્રાપ્ત થાય તે કાજેનો છે. તે હેતુ તો આપણે મૌન લીધા સિવાય પણ ખંત, કાળજી, ધીરજ અને ઉત્સાહ રાખીને કરી શકીએ એમ છીએ.

એકાગ્રતા થાય એટલે માણસ ગભરાય નહિ, નિશ્ચિંત થાય. જ્યારે એકાગ્રતા થાય ત્યારે માણસ બહુ નિશ્ચિંત થાય અને એકાગ્રતા થવાને લીધે એ વસ્તુસ્થિતિનો ઉકેલ પણ આપમેળે જલદી

મળી જાય. એકાગ્રતામાંથી ગુણ અને શક્તિનું ભાન પ્રકટે છે અને કેમ યોગ્ય વર્તવું તેની પણ સૂજ પ્રકટે છે.

ચિંતવનના વિષયમાં જોડી દેવાની કળા જે જીવને સાંપડે છે, તેને ચિંતવનના વિષયનું હાઈ હાથમાં આવી જાય છે. ચિંતવનનો વિષય સદાય સન્મુખ રહ્યા કરે છે. એમાં ને એમાં તેનું મન એકાગ્ર બન્યા કરે છે.

આપણે અંતર્મુખ થવાના પ્રયત્નો આદરીએ છીએ અને તેમાં જ્યારે એકાગ્રપણું પ્રકટે છે ત્યારે તે એકાગ્રતાનો પણ એક પ્રકારનો આનંદ હોય છે. ભાવ અને આનંદ પ્રકટે છે. એટલે જેમ જેમ એકાગ્રતા કેળવાતી જાય તેમ તેમ ભાવ વધારે ને વધારે ખીલતો જાય છે.

એકાગ્રતાનું મહત્વ કેટલું છે, તે તેનો અભ્યાસ પાડવાથી સમજાય છે.

ધ્યાન

જીવનવિકાસ પરતવેની સાધનાનો ભાવ પ્રગટાવવામાં અને તેને જીવતો રાખવામાં અનેક પ્રકારનાં જેમ સાધન છે તેમ ધ્યાન પણ એક સાધન છે.

ભૂકુટીની વચ્ચે ધ્યાન કરવાથી વિચારો આવતા અટકે છે અને હદ્ય ઉપર લક્ષ રાખ્યા કરવાથી હદ્યની ભાવનાશક્તિ અને ગુણ વિકસે છે.

ધ્યાન વખતે આસન બદલવું ન જોઈએ. ધ્યાન સમયે તંત્રા આવવા લાગે ત્યારે મોં પર પાણીથી છાલકો મારવી. ધ્યાન વખતે મનને હળવું જ રાખવું.

પ્રાર્થનામાં ઉત્કટપણે ઉત્તમ પ્રગટેલો ભાવ તે પણ એક પ્રકારનું ધ્યાન છે. તે ભાવાત્મક ધ્યાન છે.

દિલમાં દિલની એકાગ્રતાથી પ્રગટેલી પ્રાર્થના એ પણ એક પ્રકારનું ધ્યાન છે.

ધ્યાન સિવાયના સમયમાં યદ્વાતદ્વા વર્તીએ તે બરાબર નહિ.

ભાવ

જીવનવિકાસ સાધતાં સાધતાં જે ભાવ આંતરિકપણે સિદ્ધ થતો જાય તેને પ્રાપ્ત કર્મોમાં અવતારવાનો હોય છે. ઉધ્વ જીવનનો ભાવ જે કર્મમાં પ્રતિષ્ઠા ન પામે તો એ ભાવનું અવતરણ નક્કર બનતું નથી.

માત્ર દેવદર્શન, સેવાપૂજા, કથાવાર્તા કે ભજન કીર્તનમાંથી ભક્તિ પરાપણ જીવન જીવાય છે એવી ભારે બ્રમણામાં આપણો સમાજ જીવે છે. સમાજનું આ પ્રકારનું જીવન એ તો નથું અજ્ઞાનમય અને તમસ્યુક્ત છે. જો એ બધાં સાધનોનો ભાવ રોજિંદા વ્યવહાર-કર્મમાં ઉત્તરે નહિ તો એ પ્રકારનું ઘરેડયુક્ત પરંપરા પ્રાપ્ત જીવન ‘જીવન’ જ ન ગણાય.

પ્રેમ

ઉદાર માનસ એ તો પ્રેમનું પહેલું પગથિયું માત્ર છે. પરિસ્થિતિ અનુસાર સંબંધમાં આવતી અનેક પ્રકારના સ્વભાવવાળી વ્યક્તિઓને સહન કરી લેવી એ તો પ્રેમનો પ્રારંભ કહેવાય અને ગેરસમજૂતી, મર્મછેદી વાક્યોના ઘા, અન્યાયી વર્તન, કેવળ તુમાખીભર્યો કે કેવળ નીરસ કે ઉદાસીન અથવા વિરોધી વૃત્તિવાળો ભાવ, અનેક જાતના ખોટા આક્ષેપો, દુઃખ દેવા ફેંકાયેલાં લોહબાણથી પણ કઠણ ગણાતાં વાગ્બાણ-એ બધું જ મૂંગે મોઢે સહી લેવું એટલે માનસિક ઉદારતા, પણ સાચા પ્રેમને તો એવું દુઃખ નથી. અનેક શારીરિક કે માનસિક અડયણો પ્રેમ એક રૂંવાહું પણ ફરકવા દીધા વિના શાંતિથી સ્વીકારી લે છે.

ગુણભાવની કદર

ગુણભાવની કદરભક્તિ પ્રકટયા વિના આપણા પોતાનામાં જીવન પરત્વેના સદ્ગુણના સ્વીકારની ભૂમિકા અને એને ટકાવવાની ભૂમિકા કદાપિ ગ્રાપ થઈ શકતી નથી. જીવનવિકાસના ગુણોનું પ્રાકટ્ય થવું, તે આધ્યાત્મિક જીવનનું એક મોટામાં મોટું લક્ષણ છે.

ગુણોની સાથે તેની શક્તિ પણ આપોઆપ તેમાં રહેલી જ હોય છે. તે તે જીવોના જીવનમાંના સદ્ગુણથી સહજપણે આકર્ષિતા રહીએ તો જાણવું કે આપણામાં સદ્બાવની અભિરુચિ ગ્રગઠી ગઈ છે. સદ્ગુણ પરત્વેનું આકર્ષણ અને તેની કદરભક્તિ જીવનમાં જો વ્યક્ત થતાં ન અનુભવાય તો તેની (સાધકની) દિશા ખોટી છે.

દુર્લભ દેહ મનુષ્યનો

આપણો મનુષ્યદેહ એ જ પરમાત્મા જ્ઞાન પ્રાપ્તિ માટેનું એકમાત્ર સાધન છે. માનવદેહ વિના તેવું જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્યતા કોઈ પણ યોનિમાં નથી.

મનુષ્ય શરીર વડે કરીને ચેતન શોધી શકાય છે. બીજી કોઈ પણ યોનિના શરીરથી તેમ બની શકતું નથી. દ્વંદ્વ અને ગુણનું આ શરીર બનેલું છે. સામસામાં પાસાંઓ વચ્ચે જીવન હોય છે. આ સામસામાં પાસાંઓ વચ્ચે સંઘર્ષ થાય છે. એટલે ચેતનનું હાઈ મેળવવા, જ્ઞાન મેળવવા માટે મનુષ્ય શરીરમાં આવી રચના કરી છે. દેવયોનિમાં આનંદ છે, એ વાત સાચી, પણ ત્યાં વિકાસ નથી. દેવો માટે પણ મુક્તિ દુર્લભ છે. દેવોને પણ મુક્તિ મેળવવા માટે મનુષ્ય જીવન ધારણ કરવું પડે.

મृत્યુ પછી જીવાત્માની સ્થિતિ

માણસ શરીર છોડે છે ત્યાર પછી એનું એના શરીર સાથે તાદાત્મ્યપણું વળગેલું હોવાથી શરીરની આગળપાછળ એનો જીવ રહ્યા કરતો હોય છે. તેર દિવસ સુધી તે જીવ જેની સાથે એને કામ છે, લોભ છે, મોહ છે, જે જે લોકોની સાથે જીવદશાથી, એના ઉત્કટપણાથી વળગેલો છે તેવા વાતાવરણમાં રહેતો હોય છે. તે બોલી ચાલી શકતો નથી, પણ સાંભળે છે, જુએ છે પણ ખરો, માટે આ તેર દિવસ દરમિયાન શોક તો બિલકુલ ના કરવો જોઈએ, રડવું તો જોઈએ જ નહિ, પણ એ દિવસો, એ જીવનું શાંતિ-કલ્યાણ થાય એ પ્રાર્થનાના ભાવમાં ગાળીએ તો એને વધારે શાંતિ લાગે છે.

મરણ વખતે, શરીર છૂટતી વખતે, શરીરમાંથી ચેતન જ્યારે નીકળી જાય, જીવ નીકળી જાય

ત्यारे જો ભગવाननुં નाम લેવाय તો ઉત્તમ પ્રકારની ગતિ થાય છે.

મનુષ્ય શરીર ધારણ કર્યા પછી બીજી કોઈ નિભન્ન યોનિમાં જવાય જ નહિ. હા, એના ગુણધર્મ આવે, પણ ખોળિયું તો માણસનું જ રહે.

મનુષ્યના દેહાવસાન પછી તેર દિવસની અંદર મરનારની સ્મૃતિ સતેજ રખાઈને જો કાંઈ પુષ્ય, સત્કાર્ય થાય તો તેની સભાનતા ગત જીવને થાય ખરી.

જો જીવનવિકાસ કરવો હોય તો જીવિત દશામાં પોતે જાતે જ તેવું દાન હેતુના ભાવ સાથે કરવું.

‘માતૃપિતૃદોષ’ માટે નારાયણબાલિ એ તૂત છે. જો એવા માતૃપિતૃ દોષના વિચારો આવ્યા જ કરે તો તે વખતે ખરા દિલથી પ્રાર્થના કર્યા કરવી તે ઉપાય ઉત્તમ છે.

આરતી

અં શરણચરણ લેજો, પ્રભુ શરણચરણ લેજો,
 પતિત ઉગારી લેજો (૨) કર ગ્રહી ઉર લેજો. ... અં શરણ.
 મનવાણીના ભાવો, કર્મ વિશે ઉતરો, પ્રભુ (૨)
 મન, વાણી ને દિલને (૨) કૃપાથી એક કરો. ... અં શરણ.
 સર્વ મળેલાં સાથે, દિલ સદ્ગ્રાવ ઊગો, પ્રભુ (૨)
 છો અપમાન થયાં હો (૨) ત્યાંયે ભાવ બઢો. ... અં શરણ.
 નિભ પ્રકારની વૃત્તિ, ઉર્ધ્વગમન કરવા, પ્રભુ (૨)
 પ્રભુકૃપાથી મથાજો (૨) ચરણશરણ ગ્રહવા. ... અં શરણ.
 મનના સકળ વિચારો, પ્રાણતણી વૃત્તિ, પ્રભુ (૨)
 બુદ્ધિતણી સૌ શંકા (૨) ચરણકમળ ગળજો. ... અં શરણ.
 જેવા દિલ હોઈએ પ્રભુ, તેવા દેખાવા, પ્રભુ (૨)
 મતિ મુજ ખુલ્લી રે'જો (૨) સ્પષ્ટ જ પરખાવા. ... અં શરણ.
 દિલમાં કંઈક ભર્યું હો, તે થકી બીજું ઊલટું, પ્રભુ (૨)
 કદી પણ મુજથી ન બનજો (૨) એવી મતિ દેજો. ... અં શરણ.
 જ્યાં જ્યાં ગુણ ને ભાવ, દિલ ત્યાં મુજ ઠરજો, પ્રભુ (૨)
 ગુણ ને ભાવની ભક્તિ (૨) દિલ મુજ સંચરજો. ... અં શરણ.
 મન, મતિ, પ્રાણ પ્રભુ! તુજ ભાવ થકી ગળજો, પ્રભુ (૨)
 દિલમાં તુજ ભક્તિની (૨) છોળો ઊછળજો. ... અં શરણ.

પ્રાર્થના

‘પ્રભુ, ચરણ શરણમાં રાખો રે...’

પ્રભુ, ચરણ શરણમાં રાખો રે, પાવલે લાગું.
રસિયાજી અંતરયામી ! મારા હૃદયકમળના સ્વામી !
અલબેલા પ્રેમીનામી રે, પાવલે લાગું.

...પ્રભુ.

શરણાગતવત્સલ જાણી, તને જણાવી અંતર ફૂહાણી
તોયે મન રહ્યું હજુ માની રે, પાવલે લાગું.

...પ્રભુ.

અડવું બધું એનું ટાળી, હેણાવી દઈ ગિરિધારી !
પદ લગાડી દોની તાળી રે, પાવલે લાગું.

...પ્રભુ.

વૃહાલાજી સાધન કંઈ ના, દિલ-પ્રેમ-ભાવનાં ફૂલડાં,
વેરું છું નિત તમ પદમાં રે, પાવલે લાગું.

...પ્રભુ.

બાળકનું જોર કશું શું ! જો હોય કશું, તો રડવું,
એ જોરે મારે તરવું રે, પાવલે લાગું.

...પ્રભુ.

ભજન હરિને ભજતાં

હરિને ભજતાં હજ કોઈની લાજ જતી નથી જાણી રે,
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે ટેક.
વહાલે ઉગાર્યો પ્રદ્લલાદ, હિરણ્યાકંસ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે.
વહાલે નરસિંહ મહેતાને હાર હાથોહાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે.
વહાલે મીરાં તે બાઈનાં જેર, હળાહળ પીધાં રે,
પાંચાળીનાં પૂર્યાં ચીર પાંડવ કામ કીધાં રે.
આવો હરિ ભજવાનો લહાવો, ભજન કોઈ કરશે રે,
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે.

-શ્રી પ્રેમળદાસ

પૂજ્ય શ્રીમોટાનો છેલ્લો પત્ર

જે કોઈને આ અંગે લાગેવળગે છે તેઓ જોગ :-

હું, ચૂનીલાલ આશારામ ભગત ઉર્ફ 'મોટા', રહેવાસી હરિઃઊં આશ્રમ, નડિયાદ. આથી જણાવું છું કે મારી રાજ્યભૂશીથી મારી પોતાની મેળે મારા જડ દેહને છોડવા ઈચ્છા છું. આ દેહ ધણા રોગોથી ઘેરાયેલો છે અને હવે લોકકલ્યાણનાં કામમાં આવે તેમ નથી. રોગો મટવાની આશા પણ નથી. એટલે આનંદપૂર્વક શરીર છોડવું તે ઉત્તમ છે અને તે માટે યોગ્ય પળ લાગશે ત્યારે હું એમ કરી લઈશ.

મારા શરીરનો અભિસંસ્કાર એકાંતમાં શાંત જગ્યાએ, મૃત્યુ સ્થળની તદ્દન નજીકમાં કરવો અને તે પણ આપ છ જણાની હાજરીમાં જ કરવો. ધણાં ભેગાં કરવાં નહિ, તેમ મારા સેવકોને હું ફરમાવું છું. મારાં અસ્થિને પણ નદીમાં પૂરેપૂરાં પધરાવી દેવાં.

મારા નામનું ઈટ-ચૂનાનું કોઈ સ્મારક કરવું નહિ. મારા મૃત્યુ નિમિત્તે જે કંઈ નાણાભંડોળ ભેગું થાય, તેનો ઉપયોગ શાળાના ઓરડા બાંધવામાં કરવો.

લિ. ચૂનીલાલ આશારામ ભગત ઉર્ફ 'મોટા'

તા. ૧૯-૭-૧૯૭૬